



DYNAMIC INDUSTRIES LIMITED

(A Govt. Recognised Export House)

Manufacturers & Exporters of Dyes, Pigments & Dye Intermediates

Regd. Office : Plot No. 5501/2, Phase III,
Nr. Trikampura Cross Road, G.I.D.C.,
Vatva, Ahmedabad - 382 445. Gujarat (INDIA)
Tel. : 91-79-2589 7221-22-23
E-mail : info@dynamind.com

Factory : Plot No. 125, Phase I,
G.I.D.C. Estate, Vatva,
Ahmedabad - 382 445. Gujarat (INDIA)
Tel. : 91-79-2583 3835, 2589 1835
Our Website : www.dynamind.com



CIN : L24110GJ1989PLC011989
PAN : AAACD9872E
GSTIN : 24AAACD9872E1ZN

Date: May 30, 2024

BSE Limited 14th Floor, P. J. Towers, Dalal Street, Fort, Mumbai – 400001.	Stock ID: DYNAMIND Scrip Code: 524818
--	--

Sub: Newspaper Publication – Standalone Audited Financial Results for the quarter and year ended March 31, 2024

Dear Sir/Ma'am,

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended please find enclosed copies of Extract of Standalone Audited Financial Results for the quarter and year ended March 31, 2024 as published in English daily CHANAKYA NI POTH, AHMEDABAD” and in Gujarati (Local) daily “THE NEWSLINE, AHMEDABAD” both newspapers dated 29th May, 2024.

Kindly take the information on your records.

Thanking you,

Yours Faithfully,

FOR, DYNAMIC INDUSTRIES LIMITED

Ritu Agarwal
Wholetime Company Secretary
M. No: A44301

Encl.: As Above

360 One bets big on health care, technology and financial services

360 One Asset, the private equity (PE) and venture capital (VC) fund, has launched Secondaries Fund with a base size of Rs 4,000 crore and it has already crossed the halfway mark. Sameer Nath, chief investment officer (CIO) & head of PE-VC of the firm said here on Tuesday.

venture capital to growth equity and pre-IPO investments.

appreciated by a range of sophisticated investors, Nath said.

The firm has invested in 101 companies so far and of these 30 have emerged Unicorns with a valuation of \$1 billion and above.

The firm is an investor in several marquee companies, including Swiggy, National Stock Exchange and PharmEasy, among others.

Nath said its Secondaries Fund is India's first one that is addressing a massive, untapped market and building on a strong relevant track record.

The strategy and early-mover advantage have been

The fund has also launched India's first dedicated healthcare scheme, building on a strong track record. It has collaborated with five healthcare pioneers, including Ranjan Pai, chairman of Manipal Hospitals, who are anchor investors in the fund that comprises a high-powered advisory board.

The fund has a diversified portfolio and deal pipeline spanning healthcare providers, health-tech, diagnostics and life sciences.

The fund's second investment is about to close with a term sheet signed for the third investment, Nath said.

The fund has identified healthcare, financial services, consumer retail and technology for investments.

"We have already closed six investments providing visibility into 20-25 per cent of the portfolio," Nath said.

The VC & PE business of the firm has around Rs 23,404 crore in assets under management (AUM), extending from mid-stage to late-stage

P&G Hygiene appoints Mrinalini Srinivasan chief financial officer

Procter & Gamble Hygiene and Health Care, one of P&G India's listed entity that includes brands like Vicks and Whisper, announced the appointment of Mrinalini Srinivasan as the company's chief financial officer (CFO) effective June 29.

Srinivasan has worked across various finance roles in



her career spanning 16 years. She joined P&G in 2008 in India, and has worked across three geographies — Singapore, India, and Dubai, leading transformational projects and delivering outstanding results for several important P&G businesses.

We await to see how the company performs under her leadership.

Hindalco Industries looks to garner \$945 million via Novelis US IPO

Aditya Birla Group's Hindalco Industries is set to list its US subsidiary Novelis on the New York Stock Exchange (NYSE), offering 45 million shares at \$18-21 apiece. This represents 7.5 per cent of Hindalco's current stake in the company, according to public disclosures made on Tuesday.

Novelis' initial public offering (IPO) could generate up to \$945 million for Hindalco Industries as proceeds from the offer for sale. At the above mentioned range, Novelis is valued at up to \$12.6 billion. Hindalco acquired Novelis in 2007 in a deal that valued it at \$6 billion.

If the greenshoe option is exercised, the proceeds could reach \$1.08 billion at the upper end of the price band, according to a source close to the development. Based on the net debt of \$4.35 billion, according to the filing with the US Securities and Exchange Commission (SEC), the enterprise valuation of the company is estimated between \$15.2 billion and \$17 billion.

In a statement on Tuesday, Novelis said it has launched "a roadshow for the IPO of 45 million of its common shares held by Novelis' sole shareholder (Hindalco)". This will reduce Hindalco's holding in the company to 92.5 per cent.

ALSO READ: Novelis files

registration statement with US SEC for proposed IPO

The US subsidiary also expects the selling shareholder to grant the underwriters an option to purchase up to an additional 6.7 million common shares to cover over-allotments, if any, for 30 days after the date of the final prospectus. If the underwriters exercise the full over-allotment, Hindalco's stake in the company will further fall to 91.4 per cent, Novelis noted in the statement.

In February, Novelis announced plans to pursue a US market listing, with Hindalco Industries as the sole promoter offering the common shares. Currently, Novelis is a wholly-owned subsidiary of Hindalco Industries, and hence will be the sole beneficiary of the up to \$945 million proceeds.

Hindalco's management has not yet disclosed the purpose or planned utilisation of the expected proceeds. Analysts have noted the company's current debt-light balance sheet makes the utilisation of the expected IPO proceeds a curious case. As of March, Hindalco's net debt was at Rs 31,536 crore, at the consolidated level, with a treasury balance of Rs 22,965 crore.

At home, Hindalco plans to invest Rs 6,000 crore as capex

in the current financial year. The company said on Friday that FY25's capex will be funded entirely through internal accruals. In the US, Novelis is pursuing a \$4.1 billion capex for a greenfield rolling and recycling facility at Bay Minette.

Novelis' SEC filing also noted that the company will be a "controlled company" within the meaning of the rules of the NYSE and, as a result, will qualify for, and intend to rely on, exemptions from certain corporate governance requirements. The document added that the shareholder will not have the same protections afforded to shareholders of companies that are subject to such requirements.

Morgan Stanley, BofA Securities, and Citigroup are acting as lead book-running managers for the proposed offering, with Wells Fargo Securities, Deutsche Bank Securities, and BMO Capital Markets acting as additional book-running managers. BNP Paribas, Academy Securities, Credit Agricole CIB, PNC Capital Markets LLC, and SMBC Nikko are acting as co-managers for the proposed offering.

The SEC filing also noted that prior to the completion of this offering, the company will adopt an equity incentive plan.

Reliance signs deal with Russia's Rosneft to buy oil in roubles: Report

India's Reliance Industries, operator of the world's biggest refining complex, has signed a one-year deal with Russia's Rosneft to buy at least 3 million barrels of oil a month in roubles, four sources aware of the matter told Reuters.

The shift to rouble payments follows Russian President Vladimir Putin's push for Moscow and its trading partners to find alternatives to the Western financial system to facilitate trade despite U.S. and European sanctions.

A term deal with Rosneft also helps privately run Reliance to secure oil at discounted rates at a time when the OPEC+ group of oil producers is expected to extend voluntary supply cuts beyond June.

The OPEC+ group comprising the Organisation of the Petroleum Exporting Countries (OPEC) and allies including Russia is due to discuss the output cuts in an online meeting on June 2.

India, the world's third-biggest oil importer and consumer, has become the biggest buyer of seaborne Russian crude since the West halted purchases and imposed sanctions against Moscow in the aftermath of Russia's 2022 invasion of Ukraine. India has also paid for Russian crude in rupees, dirhams and Chinese yuan.

State-owned Indian refiners, meanwhile, have been tapping spot markets for Russian oil because they were unable to finalise term supplies for this year, Reuters has reported previously.

"India is a strategic partner for Rosneft oil company," the Russian company said in an emailed response to questions from Reuters, adding that it does not comment on confidential agreements with partners.

FPIs turn net debt buyers in May ahead of JP Morgan index inclusion

In a turnaround from April's selling spree, foreign investors are increasing their holdings in debt securities as the JP Morgan Index inclusion for Indian government bond approaches.

In May so far, foreign portfolio investors (FPIs) have pumped Rs 7,427 crore into debt securities on a net basis, a significant shift from April when there was net selling of Rs 11,218 crore.

"According to the schedule given by JP Morgan, the weighting will be increased by 1 per cent every month. So, passive investors will have to buy to reduce the tracking error of the index," said Naveen Singh, vice-president of ICICI Securities' primary dealership.

In September 2023, JP Morgan had announced it would include government papers, issued by the Reserve Bank of India under the Fully Accessible Route, in its widely tracked GBI-EM. The inclusion process will start from June 28 and will be phased over a 10-month period, with a 1 per cent weighting included each month until March 31, 2025. Indian bonds will have a 10 per cent weighting, similar to China.

The FPIs are back in the market because they see chances of making money as yields are expected to cool off during the financial year, said the treasury head of a private bank. "They keep doing the rebalancing of their investments in different markets. The bond inclusion was one of the reasons for the FPIs to be attracted to the market."

The yield on the benchmark 10-year government

bond have fallen by 20 basis points (bps) in May so far. It settled at 7 per cent on Tuesday. During the last quarter of FY24, FPIs infused Rs 54,492 crore into the debt market, which led to a fall in the yield on the benchmark bond of 14 bps during the period.

The debt market saw a reversal of fortunes in April after a year of cons-i-stently robust monthly inflows from FPIs, due to the surge in US Treasury yields amid escalating geopolitical tensions.

During FY24, domestic markets witnessed foreign inflows of Rs 3.23 trillion, a turnaround from the Rs 45,365 crore worth of outflow recorded in FY23. Of the total inflows, FPIs injected Rs 1.2 trillion into the debt segment, marking the highest influx since FY15, according to data on the National Securities Depository Limited.

With \$250 billion of assets under management tracking the index, the market estimates that \$25 billion inflows are expected during the period.

PRATIKSHA CHEMICALS LIMITED					
REGD. OFFICE: 3RD FLOOR, H K COMPLEX, OPP. DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007					
CIN : L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in					
PH : 079-26632390 E-MAIL: exports@dharaapratiksha.com					
EXTRACT FROM THE STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31.03.2024 (Rs. In Lacs)					
Sr. No	PARTICULARS	Quarter ended on 31-03-2024	For the year ended on 31-03-2024	Corresponding 3 Months Ended on 31st March, 2023	For the previous year ended on 31st March, 2023
1	Total income from operations	404.65	1034.67	194.31	996.70
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1.95	11.45	4.71	12.09
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	1.95	11.45	4.71	12.09
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	1.95	11.45	7.48	8.79
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1.95	11.45	7.48	8.79
6	Equity Share Capital	557.03	557.03	557.03	557.03
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year		-199.28		-199.28
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
	Basic :	-0.02	0.10	0.13	0.16
	Diluted :	-0.02	0.10	0.13	0.16

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.pratikshachemicals.com)
2. The result of the Quarter ended on 31st March, 2024 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 28th May, 2024.

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED
SD/-
Mr. JAYESH PATEL DIRECTOR (DIN : 00401109)

Place : Ahmedabad
Date : 28th May, 2024

DYNAMIC INDUSTRIES LIMITED						
CIN : L24110GJ1989PLC01989						
Regd Office :Plot No. 5501/2, Phase III, Nr. Trikumpura Cross Road, G.I.D.C., Vatva, Ahmedabad - 382 445						
Tel : 25897221-22-23, Fax: 25834292						
Email : accounts@dynamind.com Website : www.dynamind.com						
Statement of Audited Financial Result for the Quarter and Year ended on March 31, 2024 (Rs. In Lakhs except earning per share)						
Sr. No	PARTICULARS	Quarter Ended 31/03/2024 (Audited) (Refer Note 4)	Quarter Ended 31/12/2023 (Unaudited)	Quarter Ended 31/03/2023 (Audited) (Refer Note 4)	For the Year Ended 31/03/2024 (Audited)	For the Year Ended 31/03/2023 (Audited)
I	Income:					
[a]	Revenue From Operations	1 094.28	885.21	798.69	3 613.86	4 564.27
[b]	Other Income	14.58	3.45	(9.59)	31.94	126.76
II	Total Income(a+ b)	1 108.86	888.66	789.10	3 645.80	4 691.03
III	Expenses:					
[a]	Cost of materials consumed	835.70	627.37	655.02	2 668.67	2 890.37
[b]	Purchase of Stock in Trade	36.43	43.68	47.80	191.50	273.71
[c]	Changes in inventories of finished goods, work in progress and stock in -trade	(68.69)	(47.87)	(174.18)	(323.53)	280.18
[d]	Employees benefits expenses	83.14	80.78	76.71	324.37	325.49
[e]	Finance costs	16.30	4.78	3.09	36.11	18.35
[f]	Depreciation and amortisation expenses	33.27	28.43	21.80	117.63	90.26
[g]	Other expenses	160.96	163.53	175.21	672.17	656.90
IV	Total Expenses	1097.11	900.70	805.45	3 686.92	4 535.26
V	Profit / (Loss) before exceptional and extraordinary items and tax (III-IV)	11.75	(12.04)	(16.35)	(41.12)	155.77
VI	Exceptional Items	0.00	0.00	0.00	0.00	0.00
VII	Profit / (Loss) before extraordinary items and tax (V-VI)	11.75	(12.04)	(16.35)	(41.12)	155.77
VIII	Extraordinary items	0.00	0.00	0.00	0.00	0.00
IX	Profit before tax (VII-VIII)	11.75	(12.04)	(16.35)	(41.12)	155.77
X	Tax Expenses:					
(a)	Current Tax	0.00	0.00	(10.50)	0.00	42.00
(b)	Tax in respect of earlier years	0.00	(4.79)	0.00	(4.79)	0.00
(c)	Deferred Tax	3.13	(1.56)	14.76	(6.38)	(0.29)
	Total Tax Expenses	3.13	(6.35)	4.26	(11.17)	41.71
XI	Profit / (Loss) for the Period from Continuing operations (IX-X)	8.62	(5.69)	(20.61)	(29.95)	114.06
XII	Profit / (Loss) for the Period from Discontinuing operations	0.00	0.00	0.00	0.00	0.00
XIII	Tax expenses of Discontinuing operations	0.00	0.00	0.00	0.00	0.00
XIV	Profit / (Loss) for the Period from discontinuing operations (after tax) (XII-XIII)	0.00	0.00	0.00	0.00	0.00
XV	Net Profit/(loss) for the Period (XI-XIV)	8.62	(5.69)	(20.61)	(29.95)	114.06
XVI	Other Comprehensive Income					
[a]	Items that will not be reclassified to Profit or Loss (Net of Tax)	2.52	0.66	(6.72)	3.24	(0.48)
[b]	Items that will be reclassified to Profit or Loss (Net of tax)	0.00	0.00	0.00	0.00	0.00
XVII	Total Comprehensive income for the period (XV+XVI) (Comprising Profit/(Loss) and other Comprehensive income for the period)	11.14	(5.03)	(27.33)	(26.71)	113.58
XVIII	Paid-up equity share capital (face value of Rs.10)	302.85	302.85	302.85	302.85	302.85
XIX	Reserves/Other Equity				4 367.08	4 424.08
XX	Earning per equity Shares(before extra-ordinary Items)					
[a]	Basic	0.28	(0.19)	(0.68)	(0.99)	3.77
[b]	Diluted	0.28	(0.19)	(0.68)	(0.99)	3.77
XXI	Earning per equity Shares(For Discontinuing Operation)					
[a]	Basic	0.00	0.00	0.00	0.00	0.00
[b]	Diluted	0.00	0.00	0.00	0.00	0.00
XXII	Earning per equity Shares(after extra-ordinary Items)					
[a]	Basic	0.28	(0.19)	(0.68)	(0.99)	3.77
[b]	Diluted	0.28	(0.19)	(0.68)	(0.99)	3.77

Notes:
1. The financial results of the company for the quarter and year ended on 31st March, 2024 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 28th May, 2024.
2. These financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules 2015 and relevant amendments thereafter.
3. The Company operates in a single segment and in line with Ind AS - 108 - "Operating Segments", the operations of the Company fall under "Dyes and Chemicals" which is considered to be the only reportable business segment.
4. The figures for the last quarter results are the balancing figures between the audited figures in respect of the full financial year and published year to date figures upto the third quarter of the respective financial year.
5. The Board of Directors has recommended a dividend of Rs.0.50 per share (5%) of Rs.10/- each subject to approval of shareholders at the ensuing Annual General Meeting.
6. The figures of previous periods / year are reclassified, regrouped and rearranged wherever necessary so as to make them comparable with current period's figures.

For, Dynamic Industries Ltd.
SD/-
Harin Dhanvantlal Mamlatdarna
Chairman & Whole Time Director
DIN: 00536250

Date : 28th May, 2024
Place : Ahmedabad

ધી ન્યુજલાઇન

વર્ષ : ૩૦ અંક : ૨૨૮ તા.૨૯-૫-૨૦૨૪ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગંજવાલા

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં મજબૂત અપટ્રેન્ડ શરૂ

ડ્ર. ૮૫૯વાળો પારસ ડિકેન્સનો શેર પકડી શકાય



મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં મજબૂત અપટ્રેન્ડ શરૂ થઈ ગયો છે અને તેમાં ગયા અંક વખતે મોર્ડલમાં કમાવેશે તેમ દર્શાવેલું અને તે પછી ડ્ર. ૫૨૫વાળો મોઈલ ડ્ર. ૫૫૫ પહોંચ્યા પછી ડ્ર. ૫૦૧ ઉપર મળી રહ્યો છે અને આ શેરમાં હજી ધીમા સુધારાની સંભાવના મજબૂત છે.

નવા અઠવાડિયા દરમ્યાન આઈઆરએફની શેરમાં પણ ખૂબ જ સુંદર ઉછાળો જોવા મળે તેવી ગણતરી છે. ગયા અંકમાં પણ ડ્ર. ૧૬૯ના ભાવે પકડવાનું કહ્યું હતું અને તે પછી તે શેર વધીને ડ્ર. ૧૮૪ ઉપર આવ્યો છે અને

અત્યારે ડ્ર. ૧૧૨૧ ઉપર ચાલે છે. આ શેરમાં પણ આવતા થોડા દિવસોમાં ડ્ર. ૧૧૬૪ અને તે પછી ડ્ર. ૧૩૨૩નો ભાવ આવે તેવી ગણતરી છે. નાનું રોકાણ કરી શકાય.

અત્યાર સુધી ફિનોલેક્સ કેબલના શેરમાં કરન્ટ હતો પરંતુ હવે શોર્ટટર્મ ખેલાડીઓનું આકર્ષણ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ કે જે ફિનોલેક્સ પાઈપના નામથી પણ ઓળખાય છે તે શેર ઉપર શિફ્ટ થયું છે. પીવીસી પાઈપ તેમજ પીવીસી રેઝીનના ઉત્પાદનમાં આ કંપની ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અત્યારે ડ્ર. ૩૨૧ ઉપર છે અને તેમાં આવતા થોડા દિવસોમાં ડ્ર. ૩૩૩ અને તે પછી ડ્ર. ૩૬૩નો ભાવ જોવા મળે તેવી ગણતરી છે. નાનું રોકાણ કરી શકાય.

પેશાર ઇન્ડસ્ટ્રીઝનો શેર ડ્ર. ૧૪૬.૬૫ ઉપર ચાલે છે અને આ શેરમાં પણ આવતા થોડા દિવસોમાં જોરદાર ઉછાળાની જગ્યા છે. આગામી દિવસોમાં ડ્ર. ૧૫૧ અને તે પછી ડ્ર. ૧૬૪નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે. ૧૦૦-૨૦૦ શેરનું કામકાજ કરી શકાય.

વેલ્થન એન્ટરપ્રાઇઝ અત્યારે ડ્ર. ૪૨૬ ઉપર છે અને આ શેરમાં પણ લાંબી તેજની શરૂઆત થઈ ગઈ છે. આવતા થોડા દિવસોમાં ડ્ર. ૪૪૦ અને તે પછીના થોડા દિવસોમાં ડ્ર. ૪૮૦નો ભાવ આવી જાય તો સહેજ પણ નવાઈ નહિ લાગે.

કાર્મી શેરોમાં એકંદરે ઠંડક છે, પરંતુ મદીનેશનલ કાર્મી કંપની એસ્ટ્રોલોજીમાં અત્યારે કોઈક આકર્ષણ શરૂ થયું છે. ડ્ર. ૬૦૨૪વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં ડ્ર. ૬૨૨૦ અને તે પછી ધીરે ધીરે ડ્ર. ૬૮૮૦નો ભાવ આવવાની ગણતરી છે અને તેથી નાનું રોકાણ કરી શકાય.

અત્યાર સુધી કોર્પોરેશન શિપ્પીમાં આકર્ષણ હતું પરંતુ હવે તે શેર ખૂબ વધી ગયા પછી ખેલાડીઓનું કોલેક્શન મુંબઈ ખાતે મુખ્ય મથક ધરાવતી મગાંગ કોલના શેરમાં શિફ્ટ થયું છે. ડ્ર. ૩૧૭૭ ઉપર છે અને તેમાં ઉછાળાના છેલ્લા તબક્કામાં ડ્ર. ૩૨૨૨ અને તે પછી ધીરે ધીરે ડ્ર. ૩૪૩૩નો ભાવ આવી જવાની ગણતરી છે. થોડાક શેરો લઈને મૂકી શકાય.


આગામી દિવસોમાં એફએસઆઈ કંપની મેરિફોમાં પણ આકર્ષણ વધ્યું છે. ગયા અઠવાડિયે ડ્ર. ૫૮૦ના ભાવે આ શેરમાં કામ કરવાનું કહ્યું હતું અને તે પછી વધીને ડ્ર. ૬૦૪ ઉપર આવ્યો છે અને આવતા થોડા દિવસોમાં ડ્ર. ૬૦૮ અને તે પછી બે-ત્રણ અઠવાડિયામાં ડ્ર. ૬૨૪નો ભાવ જોવા મળવાની ગણતરી છે. થોડાક શેરો લઈને મૂકી શકાય.

ઓગ્રા કોર્પોરેશનનો શેર ખાસ ધ્યાન ખેંચે છે. ડ્ર. ૭૧૦ના ભાવે મળી રહેલા આ શેરમાં આવતા થોડા દિવસોમાં ડ્ર. ૭૬૫ અને તે પછી મજબૂત ઉછાળા સાથે ડ્ર. ૮૫૦નો ભાવ આવી જાય તો સહેજ પણ નવાઈ નહિ લાગે અને તેથી થોડાક શેરો લઈને મૂકી દેજો.

હેન્ડરુતાન એરોનોટિક્સ ધણા અંકથી લેવાડાવતા હતા અને હવે તે શેર ડ્ર. ૫૧૬ ઉપર આવી ગયો છે. જુલાઈ, ૨૦૨૩ વખતે આ શેર ડ્ર. ૨૦૦૦ના ભાવે મળતો હતો અને અત્યારે ડ્ર. ૫૧૬ ઉપર ચાલે છે અને હવે આ શેરમાં વધારે લોભ ન રાખતા પ્રોફિટ બુલ્ડિંગ શરૂ કરી દેજો, ભલે થોડો નફો બીજો કોઈ કમાવ.

પાવર ફિનાન્સ કોર્પોરેશનની જેમ શોર્ટટર્મ ખેલાડીઓ આઈઆરએફની શેરમાં પણ એકદમ ભુલીશ છે. આઈઆરએફ ડ્ર. ૫૫૪ ઉપર છે અને તેમાં પણ લાંબી તેજનો પ્રારંભ થઈ ગયો છે. સુંદર ઉછાળા સાથે ડ્ર. ૫૬૬ અને તે પછી થોડા દિવસોમાં ડ્ર. ૬૦૬ અને તે પછીના થોડા દિવસોમાં ડ્ર. ૬૫૬નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બે દિવસ વધે છે અને બે દિવસ તૂટે છે. માર્ચ ક્વાર્ટરના પરિણામો પણ સામાન્ય હતા. ડ્ર. ૨૮૭૨વાળા આ શેરમાં મોટી તેજની સંભાવના નહિવત. ભાવ અચાનક તૂટે અને સાથે સાથે સેન્સેક્સને પણ ખેંચી જાય તે ભય ખૂબ મોટો.



આગળ વધતો જાય છે અને નવા અઠવાડિયા દરમ્યાન તેમાં ડ્ર. ૧૫.૮૦ અને તે પછી ધીરે ધીરે ડ્ર. ૧૮નો ભાવ જોવા મળશે તે સંભાવના મજબૂત છે અને તેથી ૧૦૦૦-૨૦૦૦-૫૦૦૦ એમ યથાશક્તિ રોકાણ કરી શકાય.

ડિકેન્સ શેરોમાં અત્યાર સુધી ભારત ઇલેક્ટ્રોનિક્સનો શેર કવર કરવાનું દર્શાવતા હતા પરંતુ હવે આ શેર ડ્ર. ૨૯૭ ઉપર આવી ગયો છે અને તેથી તેને વહેતો મૂકીને ડ્ર. ૮૫૯વાળો પારસ ડિકેન્સનો શેર પકડી શકાય. એમ જોઈએ તો પારસનો શેર પણ છેલ્લા થોડા દિવસોમાં ડ્ર. ૭૦૪ અને તે પછી છેલ્લા ઉછાળામાં ડ્ર. ૧૦૬૦નો ભાવ જોવા મળવાની ગણતરી છે. નાનું રોકાણ કરી શકાય.

ડિકેન્સ અને સ્પેસ સેક્ટર માટે કમ્પોનન્ટ સપ્લાય કરતી એમટાર ટેકનોલોજીનો શેર ડ્ર. ૨૧૪૮ ઉપર ચાલે છે અને આ શેરમાં આવતા થોડા દિવસોમાં ડ્ર. ૨૧૮૮ અને તે પછી ધીરે ધીરે ડ્ર. ૨૩૫૩નો ભાવ જોવા મળે તો સહેજ પણ નવાઈ નહિ લાગે.

શોર્ટટર્મ ખેલાડીઓ અને તાતા ગ્રૂપના પ્રેમીઓનું કોલેક્શન અત્યારે ટ્રેન્ડના શેર ઉપર શિફ્ટ થઈ ગયું છે. વેસ્ટસાઈડ, સ્ટારબજારની પોપ્યુલારિટી પછી આ કંપનીએ ઝુલિયો નામની શુંખલા લોન્ચ કરી છે અને તેમાં ક્વોલિટીની સાથે સાથે એકદમ કિંમતી ભાવના રેડીમેઈડ ગાર્મેન્ટ, કોસ્મેટિક ઉપલબ્ધ હોય છે. તાજેતરના અંકમાં અનુસાર ઝુલિયો દર મિનિટે ૯૦૦૦૦ શર્ટનું વેચાણ કરી રહી છે. અને તેવી જ રીતે દર મિનિટે ૧૦૦ ડેનિમ પેન્ટનું વેચાણ પણ કરી છે અને તેના કોસ્મેટિક પણ ઉચ્ચ ક્વોલિટીના હોય છે અને કિંમત પણ એકદમ નીચી અને તેથી તેની ત્રણેય શુંખલાઓ ખૂબ જ નફાકારક રહે તે સંભાવના મજબૂત છે. ડ્ર. ૪૭૧૫વાળો ટ્રેન્ડનો શેર આવતા થોડા દિવસોમાં ડ્ર. ૪૭૭૭ અને તે પછી ધીરે ધીરે ડ્ર. ૪૮૬૯ ઉપર પહોંચી જવાની ગણતરી છે. થોડાક શેરો લઈને મૂકી શકાય.

અદાણી પાવરના શેરમાં પણ આકર્ષણ વધ્યું છે. લોકસભામાં કોંગ્રેસ અને સાથીદળોને બહુમતી મળી જાય તો અદાણી ગ્રૂપનું શું થાય તે એક અલગ પ્રશ્ન છે, પરંતુ ખેલાડીઓ અત્યારે આ શેર માટે એકદમ ભુલીશ છે. ડ્ર. ૭૦૭વાળો આ શેર આવતા થોડા દિવસોમાં ડ્ર. ૭૧૭ અને તે પછી થોડા દિવસોમાં ડ્ર. ૭૪૭ સુધી પહોંચી જવાની ગણતરી છે અને તેથી નાનું રોકાણ કરી શકાય.

અફલાતુન પરિણામો જોડે કરનાર પાવર ફિનાન્સ કોર્પોરેશનમાં પણ અત્યારે મજબૂત અપટ્રેન્ડ શરૂ થયો છે. ડ્ર. ૪૮૧.૬૫વાળો શેર આવતા થોડા દિવસોમાં જ ડ્ર. ૫૦૫ અને તે પછીના થોડા દિવસોમાં ડ્ર. ૫૩૫ ઉપર પહોંચી જાય તો નવાઈ નહિ લાગે અને તેથી તેમાં નાનું રોકાણ કરી શકાય.

આવો જ સુંદર ઉછાળો ડ્ર. ૧૪૦ ઉપરના મધરસન સુમીના શેરમાં પણ દેખાય છે. આગામી દિવસોમાં આ શેરમાં ડ્ર. ૧૪૨ અને તે પછી ડ્ર. ૧૪૮ના ભાવની ગણતરી છે અને તેથી થોડુંક રોકાણ કરી શકાય.

ઈન્ટરનેશનલ કુરિયરના ધંધામાં ઓલ્ડાઈ અંતિમ મજબૂત પોઝિશન ઊભી કરી છે અને લોકડાઉન વખતથી તેમ જોતા હશે કે આ શેર સતત કવર કરવાનું દર્શાવીએ છીએ. લોકડાઉન પછીના વર્ષમાં પણ ખૂબ જ જોરદાર રીતે પોતાનો બિઝનેસ વિકસાવ્યો છે. અત્યારે ડ્ર. ૭૩૮ ઉપર છે અને તેમાં આવતા થોડા દિવસોમાં ડ્ર. ૭૫૨ અને તે પછી થોડા દિવસોમાં ડ્ર. ૭૯૯નો ભાવ જોવા મળે તેવી ગણતરી છે અને તે રીતે થોડાક શેરો લઈને મૂકી શકાય.

ઓલિગોન કાસ્ટરોલોય ખાસ પ્રકારની એલોયનું ઉત્પાદન કરે છે અને

ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે. નાનું રોકાણ કરી શકાય.

૭૧ ઉપરના અરિહંત ફેપિટલ માર્કેટના શેરમાં પણ આકર્ષણ વધ્યું જાય છે અને આ નાના શેરમાં આવતા થોડા દિવસોમાં ડ્ર. ૭૫ અને તે પછી ડ્ર. ૭૮ અને તે પછીના થોડા દિવસોમાં ડ્ર. ૮૬નો ભાવ આવી જવાની ગણતરી છે. નાનું રોકાણ કરી શકાય.

જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો શેર ગયા અંક વખતે ડ્ર. ૧૦૧૫ના ભાવે પકડવાની વાત કરી અને તે પછી ડ્ર. ૧૦૬૯ ઉપર આવ્યો છે અને તેમાં આવતા થોડા દિવસોમાં જોરદાર ઉછાળા સાથે ડ્ર. ૧૦૮૧ અને તે પછી ડ્ર. ૧૧૧૮નો ભાવ આવાની ગણતરી છે. નાનું રોકાણ કરી શકાય.

PRATIKSHA CHEMICALS LIMITED					
REGD. OFFICE: 3RD FLOOR, H K COMPLEX, OPP. DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007					
CIN : L24110GJ1999PLC015507			www.pratikshachemicals.in		
PH : 079-26632390			E-MAIL: exports@dharaapratiksha.com		
EXTRACT FROM THE STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31.03.2024 (Rs. In Lacs)					
Sr. No	PARTICULARS	Quarter ended on 31-03-2024	For the year ended on 31-03-2024	Corresponding 3 Months Ended on 31st March, 2023	For the previous year ended on 31st March, 2023
1	Total income from operations	404.65	1034.67	194.31	996.70
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1.95	11.45	4.71	12.09
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	1.95	11.45	4.71	12.09
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	1.95	11.45	7.48	8.79
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1.95	11.45	7.48	8.79
6	Equity Share Capital	557.03	557.03	557.03	557.03
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year		-199.28		-199.28
8	Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)				
	Basic :	-0.02	0.10	0.13	0.16
	Diluted :	-0.02	0.10	0.13	0.16

Notes:
 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.pratikshachemicals.com)
 2. The result of the Quarter ended on 31st March, 2024 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 28th May, 2024.

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED
 SD/-
Mr. JAYESH PATEL
 DIRECTOR
 (DIN : 00401109)

Place : Ahmedabad
 Date : 28th May, 2024

DYNAMIC INDUSTRIES LIMITED						
CIN : L24110GJ1989PLC019899						
Regd Office : Plot No. 5501/2, Phase III, Nr. Trikumpura Cross Road, G.I.D.C., Vatva, Ahmedabad - 382 445						
Tel : 25897221-22-23, Fax: 25834292						
Email : accounts@dynamind.com Website : www.dynamind.com						
Statement of Audited Financial Result for the Quarter and Year ended on March 31, 2024 (Rs. In Lakhs except earning per share)						
Sr. No	PARTICULARS	Quarter Ended 31/03/2024 (Audited) (Refer Note 4)	Quarter Ended 31/12/2023 (Unaudited)	Quarter Ended 31/03/2023 (Audited) (Refer Note 4)	For the Year Ended 31/03/2024 (Audited)	For the Year Ended 31/03/2023 (Audited)
I	Income:					
[a]	Revenue From Operations	1 094.28	885.21	798.69	3 613.86	4 564.27
[b]	Other Income	14.58	3.45	(9.59)	31.94	126.76
II	Total Income(a+ b)	1 108.86	888.66	789.10	3 645.80	4 691.03
III	Expenses:					
[a]	Cost of materials consumed	835.70	627.37	655.02	2 668.67	2 890.37
[b]	Purchase of Stock in Trade	36.43	43.68	47.80	191.50	237.71
[c]	Changes in inventories of finished goods, work in progress and stock in -trade	(68.69)	(47.87)	(174.18)	(323.53)	280.18
[d]	Employees benefits expenses	83.14	80.78	76.71	324.37	325.49
[e]	Finance costs	16.30	4.78	3.09	36.11	18.35
[f]	Depreciation and amortisation expenses	33.27	28.43	21.80	117.63	90.26
[g]	Other expenses	160.96	160.53	175.21	672.17	656.90
IV	Total Expenses	1097.11	903.70	805.45	3 686.92	4 536.26
V	Profit / (Loss) before exceptional and extraordinary items and tax (III-IV)	11.75	(12.04)	(16.35)	(41.12)	155.77
VI	Exceptional Items	0.00	0.00	0.00	0.00	0.00
VII	Profit / (Loss) before extraordinary items and tax (V-VI)	11.75	(12.04)	(16.35)	(41.12)	155.77
VIII	Extraordinary items	0.00	0.00	0.00	0.00	0.00
IX	Profit before tax (VII-VIII)	11.75	(12.04)	(16.35)	(41.12)	155.77
X	Tax Expenses:					
(a)	Current Tax	0.00	0.00	(10.50)	0.00	42.00
(b)	Tax in respect of earlier years	0.00	(4.79)	0.00	(4.79)	0.00
(c)	Deferred Tax	3.13	(1.56)	14.76	(6.38)	(0.29)
	Total Tax Expenses	3.13	(6.35)	4.26	(11.17)	41.71
XI	Profit / (Loss) for the Period from Continuing operations (IX-X)	8.62	(5.69)	(20.61)	(29.95)	114.06
XII	Profit / (Loss) for the Period from Discontinuing operations	0.00	0.00	0.00	0.00	0.00
XIII	Tax expenses of Discontinuing operations	0.00	0.00	0.00	0.00	0.00
XIV	Profit / (Loss) for the Period from discontinuing operations (after tax) (XII-XIII)	0.00	0.00	0.00	0.00	0.00
XV	Net Profit/(loss) for the Period (XI-XIV)	8.62	(5.69)	(20.61)	(29.95)	114.06
XVI	Other Comprehensive Income					
[a]	Items that will not be reclassified to Profit or Loss (Net of Tax)	2.52	0.66	(6.72)	3.24	(0.48)
[b]	Items that will be reclassified to Profit or Loss (Net of tax)	0.00	0.00	0.00	0.00	0.00
XVII	Total Comprehensive income for the period (XV+XVI) (Comprising Profit/(Loss) and other Comprehensive income for the period)	11.14	(5.03)	(27.33)	(26.71)	113.58
XVIII	Paid-up equity share capital (face value of Rs.10)	302.85	302.85	302.85	302.85	302.85
XIX	Reserves/Other Equity				4 367.08	4 424.08
XX	Earning per equity Shares(before extra-ordinary Items)					
[a]	Basic	0.28	(0.19)	(0.68)	(0.99)	3.77
[b]	Diluted	0.28	(0.19)	(0.68)	(0.99)	3.77
XXI	Earning per equity Shares(For Discontinuing Operation)					
[a]	Basic	0.00	0.00	0.00	0.00	0.00
[b]	Diluted	0.00	0.00	0.00	0.00	0.00
XXII	Earning per equity Shares(after extra-ordinary Items)					
[a]	Basic	0.28	(0.19)	(0.68)	(0.99)	3.77
[b]	Diluted	0.28	(0.19)	(0.68)	(0.99)	3.77

Notes:
 1. The financial results of the company for the quarter and year ended on 31st March, 2024 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 28th May, 2024.
 2. These financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules 2015 and relevant amendments thereafter.
 3. The Company operates in a single segment and in line with Ind AS - 108 - "Operating Segments", the operations of the Company fall under "Dyes and Chemicals" which is considered to be the only reportable business segment.
 4. The figures for the last quarter results are the balancing figures between the audited figures in respect of the full financial year and published year to date figures upto the third quarter of the respective financial year.
 5. The Board of Directors has recommended a dividend of Rs.0.50 per share (5%) of Rs.10/- each subject to approval of shareholders at the ensuing Annual General Meeting.
 6. The figures of previous periods / year are reclassified, regrouped and rearranged wherever necessary so as to make them comparable with current period's figures.

For, Dynamic Industries Ltd.
 SD/-
Harin Dhanvantlal Mamlatdarna
 Chairman & Whole Time Director
 DIN: 00536250

Date : 28th May, 2024
 Place : Ahmedabad